https://archive.org/details/bk1030/page/n0/mode/1up

2019-04 -Bilimora and Tamil Nadu -Satpanthis leaving (1030)

All Items on https://archive.org/details/realpatidar

Full Library on https://realpatidar.com/library

એપ્રિલ-૨૦૧૯

પાટીદાર સૌરભ

ત્રિવાર્ષિક લવાજમ રૂ.૪૫૦

નામ સોશિયલ, કામ એન્ટિ-સોશિયલ!



વાહ મુંબઈ વાહ!

જેઠા લાલજી ચોપડા પાટીદાર 'રત્ન' બન્યા!

તામીલનાડુમાં ભડકો!

સનાતનીઓના ભોગે સતપંથીઓ ન જ ખપે...

બીલીમોરામાં ઈતિહાસ રચાયો, ૧૪૦ સતપંથીની ભવ્ય 'ઘરવાપસી'

https://archive.org/details/bk1030/page/n1/mode/1up

Real Patidar Library

https://www.realpatidar.com/library

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

No specific pages. See whole book.
References by: RealPatidar.com

https://archive.org/details/bk1030/page/n2/mode/1up

realpatidar.com

એપ્રિલ-૨૦૧૯

પાટીદાર સૌરભ

ત્રિવાર્ષિક લવાજમ રૂ.૪૫૦

નામ સોશિયલ, કામ એન્ટિ-સોશિયલ!



વાહ મુંબઈ વાહ!

જેઠા લાલજી ચોપડા પાટીદાર 'રત્ન' બન્યા!

તામીલનાડુમાં ભડકો!

સનાતનીઓના ભોગે સતપંથીઓ ન જ ખપે...

બીલીમોરામાં ઈતિહાસ રચાયો, ૧૪૦ સતપંથીની ભવ્ય 'ઘરવાપસી'

realpatidar.com

https://archive.org/details/bk1030/page/n3/mode/1up

realpatidar.com

તંત્રીલેખ

બીલીમોરામાં આનંદ ભયો..તામીલનાડુમાં ભડકો

કેન્દ્રીય સમાજની સનાતન નીતિ અને સનાતની ચળવળકારોના સતત પ્રયાસોનું પરિણામ હવે સમાજમાં દેખાઈ રહ્યું છે. માતૃ સંસ્થાની અપીલ બાદ એકલદોકલ સતપંથી સમાજના સનાતની પ્રવાહમાં ભળી ગયાના કિસ્સા અત્યાર સુધી ઘણા બન્યા છે પણ એકસામટા ૧૪૦ સતપંથી ભાઈઓ સાગમટે સનાતની વિચારધારા સાથે જોડાયા હોય તેવી વિરલ અને ઐતિહાસીક ઘટના દક્ષિણ ગુજરાતના બીલીમોરામાં બની છે.

કેન્દ્રીય સમાજના આદેશ બાદ દરેક ઝોન સમાજ અને સ્થાનિક સમાજોએ અપનાવેલ કડક વલણને કારણે હવે પરિણામો વર્તાઈ રહ્યા છે. સૌથી મોટી તકલીફ સગપણમાં થઈ રહી હતી જેને લઈ યુવા પેઢી સમાજના સામાન્ય પ્રવાહ તરફ વળવા પ્રેરીત થઈ હોય તેવી સ્પષ્ટ છાપ બીલીમોરાના સામૂહિક 'ઘરવાપસી'ના કાર્યક્રમ પરથી જણાય છે.

આ એક ઉમદા શરૂઆત છે. કેન્દ્રીય સમાજના ધારાધોરણ પાળવાની શરતે કચ્છના સ્થાનિક સનાતની સમાજની NOC મેળવ્યા બાદ બીલીમોરામાં પ્રવેશ આપવામાં આવ્યો છે. બીલીમોરાના સનાતની સમુદાયે ઉદારતા દાખવી ઉમળકાથી આ ભાઈઓને આવકાર્યા છે. હવે તેમના વિશ્વાસને સાર્થક કરી અન્ય ગામો માટે માર્ગદર્શક ભૂમિકા ભજવવાની બહુ મોટી જવાબદારી આ ૧૪૦ સભ્યોની છે. આશા રાખીએ કે બીલીમોરાની આ સનાતની કાર્યવાહી અન્ય પ્રદેશોમાં પણ આગળ ધપે.

બીલીમોરાના મંગળ સમાચાર ટાણે જ દક્ષિણ ભારતમાંથી માઠા સમાચાર આવ્યા છે. હજુ બે મહિના પહેલાં જ પોંડીચેરીમાં યોજાયેલ દક્ષિણ ભારત સમાજની વાર્ષિક સામાન્ય સભામાં ૧૮૦૦ જ્ઞાતિજનોની વિશાળ હાજરીમાં સતપંથમાંથી સનાતનમાં આવનારા માટે કડક નીતિનિયમો ઘડી કાઢવામાં આવ્યા હતા પણ ત્યાર બાદ સમાજના આ સૌથી મહત્વના ઝોનમાં જે કંઈ થયું તે અતિ ચોંકાવનારું અને ચિંતાજનક છે.

જનરલ મિટિંગમાં નક્કી કરવામાં આવેલ કે જે સતપંથી લોકો પ્રેમથી આપણા નિયમો અપનાવીને આવતા હશે તેમને આપણે લઈ લેવા પણ ત્યાર બાદ દક્ષિણ ભારતના સતપંથીઓની મદદથી પીરાણા તરફથી વકીલોની નોટીસ મોકલવામાં આવતાં ઉભી થયેલ અસાધારણ પરિસ્થિતિના નિરાકરણ માટે ત્રિચી ખાતે ૧૦ માર્ચના દક્ષિણ ભારત સમાજની કારોબારી બોલાવવામાં આવેલ.

આ કારોબારીમાં ૮૦ થી ૮૫ ટકા ઘટક સમાજનો મત પોંડીચેરીના ઠરાવને વળગી રહીને જ સતપંથીઓને પ્રવેશ આપવામાં આવે તેવો સ્પષ્ટ હતો. બીજી તરફ ઝોન પ્રમુખ શિવગણભાઈ વાસાણીએ કોઈ ભેદી કારણોસર યુ-ટર્ન મારતાં બેઠકમાં સોપો પડી ગયો હતો અને સનાતનીઓ સમસમી ગયા હતા. સતપંથીઓને કોઈ પણ શરત વગર લઈ લેવાની વાત માત્રથી સનાતનીઓમાં જબરો આક્રોશ ફેલાયો હતો.

ચોંકાવનારી વાત તો એ છે કે ઝોન પ્રમુખ શ્રી શિવગણભાઈએ કેન્દ્રીય સમાજને ટાંકીને સ્પષ્ટ જણાવેલ કે, 'કેન્દ્રીય સમાજનો આદેશ છે કે બધાને લઈ લેવા અને ડખા ઓછા કરવા !' જો કે કેન્દ્રીય સમાજે મોડેથી એક યાદીમાં જ્ઞાતિજોગ સ્પષ્ટીકરણ કરી આવી છૂટછાટની ભલામણ દક્ષિણ ભારત સમાજમાં કોઈને પણ ક્યારેય કરી ન હોવાની સ્પષ્ટ વાત કરતાં 'દૂધનું દૂધ અને પાણીનું પાણી' થઈ ગયું છે ! સમાજમાં પ્રમુખસ્થાનો પર બેઠેલા લોકો કેટલી સહેલાઈથી તાકીયા પદ્ધતિનો શિકાર બની જાય છે તેનું લેટેસ્ટ ઉદાહરણ દક્ષિણ ભારત સમાજ છે.

સનાતની સમાજના ભોગે સતપંથીઓને લેવાની વાત માત્રથી દક્ષિણ ભારત સમાજના લોકો ભડકી ગયા છે અને સર્વત્ર વિરોધનો સૂર હવે વંટોળ બની રહ્યો છે. સતપંથીઓ અને દૂધ-દહીંવાળાની ઘણી આળ પંપાળ કરી, પણ અનુભવે હવે સમજાઈ જવું જોઈએ કે 'લાતોં કા ભૂત બાતોં સે નહીં માનતે !' કેન્દ્રીય સમાજે ત્વરીત કડક કાર્યવાહી કરી તામીલનાડુના મવાળવાદી તત્ત્વોની સાન ઠેકાણે લાવવી જ રહી.

હાલ તુરત બીલીમોરા સમાજ અને દક્ષિણ ભારતના જાગૃત સનાતનીઓને અભિનંદન !

■

realpatidar.com

https://archive.org/details/bk1030/page/n4/mode/1up

realpatidar.com

આક્રોશ

પ્રમુખ શ્રી શિવગણભાઈના વલણ સામે સનાતનીઓમાં તીવ્ર રોષ

સનાતનીના ભોગે સતપંથીને લેવાના મુદ્દે તામીલનાડુ ઝોનમાં ભડકો

દક્ષિણ ભારત સમાજમાં સતપંથીઓને સનાતન સમાજમાં પ્રવેશ આપવા બાબતે અગાઉ પોંડીચેરીની વાર્ષિક સામાન્ય સભામાં કડક નીતિનિયમો ઠરાવેલા હોવા છતાં આ મુદ્દે ઢીલું વલણ દાખવવા થઈ રહેલા પ્રયાસો સામે સમાજમાં ભડકો થયો છે અને તીવ્ર જનાક્રોશ ફેલાયો છે.

હજુ બે મહિના પહેલાં જ સમાજના વાર્ષિક મેળાવડામાં ૧૮૦૦ લોકોની વિશાળ ઉપસ્થિતિમાં સતપંથમાંથી સનાતનમાં આવવા માંગતા સભ્યો માટે ભૂતકાળના કડવા અનુભવોને આધારે આ નિયમોને ધારદાર બનાવવામાં આવ્યા હતા અને તેને સર્વાનુમતે ઠરાવવામાં આવ્યા હતા. જે લોકો પ્રેમથી આ નિયમો અપનાવીને આવતા હશે એમને સનાતન સમાજમાં લઈ લેવાના એવું નક્કી કરવામાં આવેલ.

પોંડીચેરીની મિટિંગમાં આવો સ્પષ્ટ નિર્ણય લેવાયો હોવા છતાં દક્ષિણ ભારતના સતપંથીની મદદથી પીરાણા તરફથી વકીલોની નોટીસ મોકલવામાં આવતાં ચોંકી ઉઠેલા સનાતનીઓની પહેલથી ૧૦ માર્ચના એક અરજન્ટ કારોબારીની મિટિંગ ત્રિચી ખાતે બોલાવવામાં આવેલ.

આ બેઠકમાં પ્રમુખ શ્રી શિવગણભાઈ વસાણીએ હાજર રહેલા કારોબારી સભ્યોને 'સતપંથી ભાઈઓ આવવા માંગે છે તો શું કરીએ?' તે મુદ્દા પર સભ્યોની રાય માંગતાં કારોબારીમાં હાજર ૮૦ થી ૮૫ ટકા સભ્યોએ પોતાની ઘટક સમાજનો વિચાર જણાવેલ જેમાં નીચે જણાવેલ મુદ્દાઓ ઉપસ્થિત કરી સતપંથીઓને લેવામાં ઉતાવળ ન કરવા વિનંતી કરવામાં આવેલ.

(૧) આપણી દક્ષિણ ભારત સમાજના કહેવાથી જે લોકોને રામપર સમાજે સમાજ બાર કર્યા છે તેને પહેલા ગામ સ્વીકારે પછી આપણે વિચારીએ.

(૨) હજી મહિના પહેલા જેમને પીરાણામાંથી બોલાવીને પૂજા પાઠ કર્યા તેમને થોડા દિવસ પછી સમજી વિચારી લેવા.

(૩) જેમને આપણી સામે કોર્ટની નોટીસ મૂકી અને આપણી સામે અઠવાડિયા પહેલા પણ રમત રમતા હતા તેમને પણ લેવાથી પહેલા ગંભીરતાથી વિચારવું પડે.

(૪) દક્ષિણ ભારત સમાજે નક્કી કરેલ કે જે સતપંથી નખત્રાણા ખાતે આવી રહેલ દશાબ્દી મહોત્સવમાં ભાગ લેશે તેને ન લેવા. તો આવાને પણ વિચારીને નિર્ણય કરવો.

(૫) ઈસ્લામ (સતપંથ) ખતરામાં છે કરીને હાલમાં પીરાણાવાળા પંકજ અને ત્રિચીવાળા હસમુખ સાથે જે વાતચિતનો

એવા સતપંથીઓને આપણા સમાજમાં લેવાય?

દક્ષિણ ભારત સમાજની જનતા સતપંથીઓને સનાતન સમાજમાં ભેળવવા બાબતે નીચે જણાવેલ ધારદાર સવાલો કરી રહી છે...

- આપણા કહેવાથી રામપર (સરવા) સમાજ કડક પગલાં લેતી હોય અને ૧૨ પરિવાર સાથે અસહકાર કરતી હોય ત્યારે તેવા પરિવારોને દક્ષિણ ભારત સમાજમાં લેવાય? રામપર સમાજના મંત્રી ફોન કરી પૂછે છે... શું જવાબ આપવો?
- રામપર સમાજને સેંગોટટાથી સામેવાળાએ ધમકી દીધી છે કે, હવે અમે શું કરીએ છીએ તે જો જો...?! આવા તત્ત્વો અહીંની સમાજમાં ભળવાની વાત કરતા હોય તો તેમને લેવાય?
- મને સમાજમાંથી કોણ કાઢે છે? જોઈ લઈશ ! આવા શબ્દો જે લોકો છોડતા હોય તેમને આપણા સમાજમાં લેવાય?
- હું સાડી સાતવાર સતપંથી છું. સતપંથ ટકાવવા ધંધો મૂકી દઈશ અને માર્કેટીંગ માટે અમદાવાદથી માણસો તેડાવીને સતપંથને ટકાવવા જે જોશે તે કરીશ એમ કહેતા હસમુખ છાભૈયા પરિવારને સમાજમાં લેવાય?
- તામીલનાડુમાં સ્થાનિક લોકો ભેગા સ્ટેજમાં બેસી હલકાઈ કરતા અમૃત છાભૈયા ફોન કરી કહે છે કે અમે સતપંથ ધર્મ નહીં છોડીએ, અમે પાકા સતપંથી છીએ... તો આવાને લેવાય?
- સનાતનમાં આવવાથી પહેલાં જ, લોકલ સમાજમાં અમે જ સંચાલન કરશું એવી શરત રાખતા હોય એવા લોકોને લેવાય?

આ બધું વિચારતા, આ બધાયને અમુક સમય પૂરતા હાલમાં નહીં લઈએ તો આપણું શું બગડી જવાનું છે? પહેલાં આપણા સમાજમાં શાંતિ હતી, જ્યારે આ અમુક પરિવારને લેવાની વાત કરી છે ત્યારે અશાંતિ આવી ગઈ છે...

સનાતની સમાજના ભોગે સતપંથીઓને લેવાની વાતો કરનારા લોકોથી સાવધાન !

realpatidar.com

realpatidar.com

પ્રમુખ શિવગણભાઈ વાસાણીના નિવેદનનું ખંડન કરતી કેન્દ્રીય સમાજ

ત્રિચીમાં ૧૦ માર્ચના મળેલ દક્ષિણ ભારત સમાજની કારોબારી બેઠકમાં સતપંથીઓને લેવા બાબતે સનાતનીઓના તીવ્ર વિરોધ બાદ પ્રમુખ શ્રી શિવગણભાઈ વાસાણીએ જણાવેલ કે કેન્દ્રીય સમાજનો આદેશ છે કે બધાને લઈ લેવા અને ડખા ઓછા કરવા...

પ્રમુખશ્રીના આ ચોંકાવનારા નિવેદન બાદ કારોબારી સભામાં અને ત્યાર બાદ સમગ્ર દક્ષિણ ભારતમાં ભારે હોબાળો થતાં આખરે હરકતમાં આવેલ કેન્દ્રીય સમાજે પ્રમુખ શ્રી શિવગણભાઈના નિવેદનનું સ્પષ્ટ રીતે ખંડન કરી જ્ઞાતિજોગ સ્પષ્ટીકરણ બહાર પાડેલ છે.

તા.૩૦-૩-૨૦૧૯ના મહામંત્રી પુરુષોત્તમભાઈ ભગતની સહીથી બહાર પાડવામાં આવેલ આ સ્પષ્ટીકરણમાં જણાવાયું છે કે, દક્ષિણ ભારત ઝોન સમાજની પ્રવર્તમાન સ્થિતિ બાબતે કોઈ પણ પ્રકારની છૂટછાટની ભલામણ કે આદેશ કેન્દ્રીય સમાજે કોઈને પણ કરેલ નથી !

કેન્દ્રીય સમાજના આ સ્પષ્ટીકરણ બાદ હવે જોઈએ... તામીલનાડુમાં કેવા ખેલ ખેલાય છે?

ઓડિયો અને ત્યારબાદ દક્ષિણ ભારતમાં પીરાણાથી લોકોને બોલાવી દક્ષિણ ભારતમાં સંપર્ક યાત્રામાં જોડાયેલ તેમના માટે તો ખાસ સોચી સમજી વિચાર કરવો.

(૬) હાલમાં દક્ષિણ ભારતમાં તામિલ ભાઈઓ સાથે મળી જાહેરસભામાં સનાતની પટેલ જ્ઞાતિને બદનામ કરી છે તેને પણ સમજી વિચારીને લેવા.

(૬) શીંગોટા વાલજી નાનજી રંગાણી રામપરવાળા જેમને ૧૫ મહિના પહેલા અરજી આપેલ અને ચાર પાંચ મહિમામાં કચ્છના દાખલા આપશે તેવો વાયદો કરેલ જે આજ ૧૫ મહિના થવા છતાં રામપર સમાજને આજ સુધી વિનંતી નથી કરી અને પૂછીએ તો એમ કહે છે કે રામપર સમાજને હું પગે લાગવા નહીં જવું. મને દક્ષિણ ભારત સમાજમાંથી-કોણ કાઢે છે તે જોઈ લઉં છું અને 'તમારી સમાજ' ગાલાવેલી છે એવું કહે છે. વાલાભાઈને છેલ્લે જનરલ સભામાં જાન્યુઆરી ૩૧નો સમય આપવામાં આવ્યો હતો પણ હજુ સુધી દાખલા લઈને નથી આવ્યા.

ઉપરોક્ત મુદ્દાઓ અંગે સભ્યોએ વિગતવાર ચર્ચા કરી ઉતાવળમાં કાચું કામ કરી સતપંથીઓને લેવામાં આવશે તો તેના ભયસ્થાનો અંગે પણ લાલબત્તી ધરી અને પ્રમુખશ્રીને કંઈક પગલાં લેવાની વિનંતી કરવામાં આવેલ પણ આશ્ચર્યજનક રીતે 'સનાતની' પ્રમુખશ્રી શિવગણભાઈ વાસાણીએ એ વાતને સાઈડમાં મૂકી દીધી હતી !

આવી રીતે કારોબારી મિટિંગમાં હાજર બધા સભ્યોએ સનાતનીઓના રક્ષણની વાત કરી પણ પ્રમુખશ્રી તેમાં સહમત ન થતાં સભામાં બધાને આંચકો લાગેલ ! પ્રમુખસ્થાનેથી એવું કહેવામાં આવ્યું કે કેન્દ્રીય સમાજનો આદેશ છે કે બધાને લઈ લેવા અને ડખા ઓછા કરવા. તેથી મારો પણ આદેશ છે કે બધું બાજુમાં મૂકીને આપણા નિયમમાં ફેરફાર કર્યા વગર એકવાર લઈ લઈએ. જે કાયદાનું પાલન નહિં કરે તેમને કાઢી મૂકીશું !

પ્રમુખશ્રીની આ પ્રકારની નબળી વાત બાદ સભામાં ફરી વાત ઉપડી કે સેંગોટાવાળા વાલજીભાઈ રંગાણીને સનાતનમાં લીધા બાદ હજુ જરૂરી કાગળો આપ્યા નથી અને 'હું કંઈ નહીં કરું... તમારી સમાજ શું કરી લેશે? આવી ઉદ્ધત વાતો કરે છે તો તેમને પહેલાં સમાજમાંથી કાઢો તો કહેવાય કે કાયદો કામ કરે છે તો તેના જવાબમાં પણ એમ કહેવામાં આવ્યું કે એમની વાત ન કરો !!'

દક્ષિણ ભારત સમાજમાં સતપંથ-સનાતન મુદ્દે સનાતનીઓમાં જ આપસમાં જાગેલો વિવાદ કેન્દ્રીય સમાજ સુધી પહોંચતાં કેન્દ્રીય સમાજના ઉપપ્રમુખ અને તામીલનાડુના પ્રભારી ગોપાલભાઈ ભાવાણીએ દક્ષિણ ભારત સમાજના પ્રમુખ શ્રી શિવગણભાઈ વાસાણીને એક સંદેશ મોકલી સતપંથની તાકીયા પદ્ધતિનો ભોગ ન બનવા અને બગડતી પરિસ્થિતિને તુરંત રોકવા માટે ત્વરીત પગલાં લેવા અપીલ કરી છે.

તેમણે આ મડાગાંઠના નિરાકરણ માંટે દક્ષિણ ભારત સમાજની કારોબારી સભા બોલાવવાનું અને તેમાં કેન્દ્રીય સમાજને બોલાવવાનું પણ સૂચન કર્યું હતું. કારોબારી સભા બોલાવતા પહેલાં સતપંથીઓના ફોર્મ સ્વીકારવાનું સદંતર બંધ કરી દેવાની ભલામણ ગોપાલભાઈએ આ સંદેશમાં કરવાની સાથે સર્વાનુમતે નિર્ણય લેવા અને ફોર્મ સ્વીકારવામાં ખોટી ઉતાવળ ન કરવાની પણ ભલામણ કરી હતી.

દરમ્યાન તામીલનાડુમાં જાગેલા આ વિવાદની અગનઝાળ સોશ્યલ મીડિયા થકી દેશભરમાં ફેલાતાં સનાતની સમુદાયમાં ચિંતા પ્રસરી છે. તામીલનાડુના બહુમતી સનાતનીઓની લાગણી અને માંગણીને ધ્યાને લઈ સતપંથીઓને પ્રવેશ આપવા મુદ્દે ઢીલી નીતિ અપનાવતા અને છાવરતા આગેવાનો સામે કેન્દ્રીય સમાજ કડક હાથે કાર્યવાહી કરે તેવી લાગણી જ્ઞાતિજનોમાં હવે પ્રબળ બની રહી છે.

૧૦ માર્ચની ત્રિચીની કારોબારી મિટિંગ બાદ સમાજના હોદ્દેદારોના

realpatidar.com

realpatidar.com

આમને/સામને

કેન્દ્રીય સમાજનો આદેશ છે કે બધાને લઈ લેવા અને ડખા ઓછા કરવા. તેથી મારો પણ આવો જ આદેશ છે.

- શિવગણભાઈ વાસાણી
પ્રમુખ, દક્ષિણ ભારત ઝોન સમાજ

દક્ષિણ ભારત ઝોન સમાજની પ્રવર્તમાન સ્થિતિ બાબતે કોઈ પણ પ્રકારની છૂટછાટની ભલામણ કે આદેશ કેન્દ્રીય સમાજે કોઈને પણ કરેલ નથી.

- પુરુષોત્તમભાઈ ભગત
મહામંત્રી, કેન્દ્રીય સમાજ

વિરોધાભાસથી વલણ પણ સોશ્યલ મીડિયા મારફત બહાર આવી રહ્યા છે. આ મિટિંગમાં જ્યારે મોટી સંખ્યામાં વિરોધ થયો ત્યારે કટ્ટર સનાતનીઓને શાંત કરવા પ્રમુખશ્રીએ જણાવેલ કે કોઈ પણ ફેરફાર કરવામાં નહીં આવે. પરંતુ મિટિંગના બે દિવસ બાદ ઉપપ્રમુખ ખીમજીભાઈ ભાવાણી (ચેન્નઈ) એ મોકલેલ મેસેજ અતિ ચોંકાવનારો છે.

આ મેસેજમાં ખીમજીભાઈએ સતપંથીઓને સનાતની સમાજમાં ભેળવ્યા બાદ હોદ્દા આપવા બાબતે જણાવેલ છે કે, દક્ષિણ ભારત સમાજ તેમજ ઝોનલ સમાજમાં તેમને ન લેવા એ બરાબર છે પણ ઘટક સમાજ કે જ્યાં સ્થાવર મિલકત છે તે સમાજ સમજી વિચારીને યોગ્ય નિર્ણય લે જેથી સમાજમાં એકતા રહે, બાકી જેમ યોગ્ય લાગે તેમ કરીએ, મારો અંગત કોઈ વાંધો નથી !

સતપંથમાંથી આવનાર સભ્યને છ વર્ષ સુધી કોઈ પણ જાતના હોદ્દા ન આપવાનો નિયમ અમલમાં હોવા છતાં ઉપપ્રમુખશ્રીના આ પ્રકારના સંદેશથી કટ્ટર સનાતનીઓ હચમચી ગયા છે અને સોશ્યલ મિડિયામાં નિયમ તોડવાની ઉપપ્રમુખશ્રીની વાત પર પસ્તાળ પાડી રહ્યા છે. જો આ નિયમ ન પળાય તો આગામી જાન્યુઆરીની ચૂંટણીમાં ગઈકાલ સુધી જે સતપંથના પ્રમુખ હતા તે દક્ષિણ ભારત સમાજનો પ્રમુખ બની જાય તે ભય સનાતનીઓને સતાવી રહ્યો છે.

સમાજના સહમંત્રી જીતુભાઈએ ઉપપ્રમુખ શ્રી ખીમજીભાઈને સમાજ અને સનાતનના હિતની વાત્ હોય ત્યારે ઠંડા મગજથી વિચારી સનાતની એકતા અને ગૌરવ ટકી રહે તે જોવા અપીલ કરી છે. ઈરોડના જગદીશભાઈ નાકરાણીએ જીતુભાઈની વાતમાં સહમત થતાં જણાવેલ છે કે આપણા લક્ષ્મીનારાયણ ધર્મની હાંસી ઉડાડતા હોય, અભદ્ર ટીપ્પણી કરતા હોય, કચ્છમાં સતપંથી રહેવા માગતા હોય અને અહીં પોતાના સ્વાર્થ ખાતર સિર્ફ આપણી સમાજમાં જોડાવવા માંગતા હોય તો પણ આપણે આંખો બંધ કરી સ્વીકારતા હોઈએ તે કેટલું ઉચીત છે?

અત્યારે સતપંથી ભાઈઓને આપણી સમાજમાં જોડાવવા બાબતે સમાજમાં કુસંપ, મતભેદ થઈ રહ્યો છે તો એ લોકો સનાતનમાં જોડાય પછી કુસંપ, મતભેદ વધશે તેવી ભીતી વ્યક્ત કરતાં જગદીશભાઈએ સામેવાળા સંપૂર્ણપણે સતપંથને ત્યજી દીધો છે અને સાચા દિલથી સનાતની વિચારધારા સ્વીકારતા હોવાની આપણને ખાતરી થાય તો જ સ્વીકારી શકાય તેવો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે.

સતપંથીઓને સનાતન પ્રવાહમાં લેવાના મુદ્દે તામીલનાડુમાં કેટલાક વગદાર સતપંથીઓ સમાજના નીતિનિયમોથી ઉપરવટ જઈ ભળવા માંગતા હોઈ આ બબાલ સર્જાઈ છે અને કટ્ટર સનાતનીઓ તેનો તીવ્ર વિરોધ કરી રહ્યા છે. નામકકલ ઝોનમાં સતપંથમાંથી આવેલ એક સનાતની પૂછે છે કે, દેશમાંથી દાખલો લઈ આવવો એ કાયદો શું અમારા જેવા જીણા માણસને જ લાગે? મોટા માણસોને નહીં?

આ મુદ્દે જે રીતે વિરોધનો વંટોળ ઉપડ્યો છે તે જોતાં તામીલનાડુમાં પરિસ્થિતિ જલદી થાળે પડે તેમ નથી. સમાજની એકતાના નામે સતપંથીઓ માટે લાલ જાજમ પાથરતા તત્ત્વોની મેલી મુરાદ પારખી ગયેલા સનાતનીઓ હવે આ પ્રકરણે લડી લેવાના મૂડમાં છે અને 'આરપાર' ની લડાઈ માટે મનસૂબો બનાવી લીધો હોવાનું તામીલનાડુમાંથી મળી રહેલા અહેવાલો જોતાં જણાય છે.

બીજી તરફ કેન્દ્રીય સમાજ તામીલનાડુમાં ઉભા થયેલા સંકટમાંથી આ ઝોન વહેલી તકે બહાર આવે તે માટે ચિંતિત છે અને દક્ષિણ ભારત સમાજના કાર્યકરો સાથે સતત સંપર્કમાં છે. મડાગાંઠના ઉકેલ માટે તામીલનાડુના પ્રભારી અને કેન્દ્રીય સમાજના ઉપપ્રમુખ ગોપાલભાઈ ભાવાણી સતત પ્રયાસો કરી રહ્યા છે.

અત્રે એ યાદ રહે કે દક્ષિણ ભારતમાંથી પીરાણાને ખૂબ મોટી વાર્ષિક સહાય ધર્મના નામે મળે છે. એટલે સનાતન સમાજમાં ભળવા માંગતા સતપંથીઓના પ્રવાહને રોકવા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે અને સમાજના મવાળ લોકોનો સહકાર લઈ સમગ્ર સમાજને 'હાઈજેક' કરવાની ખતરનાક સાજિશના સંકેત સાંપડી રહ્યા છે.

તામીલનાડુના સનાતનીઓમાં જ ઉભો થયેલ આ 'ડખો' શાંત કરવા વહેલી તકે સમાજની કારોબારી બોલાવવા કેન્દ્રીય સમાજે કરેલ અપીલની હજુ સુધી કોઈ ધારી અસર ન થતાં અહીં ઉચાટ વધી રહ્યો છે. કેન્દ્રીય સમાજની એક ઉચ્ચસ્તરીય ટીમ તાત્કાલિક તામીલનાડુની મુલાકાત લઈ કાર્યવાહી કરે તેવી પ્રબળ લોકલાગણી સમગ્ર સમાજમાં પ્રવર્તી રહી છે.

❖

realpatidar.com

https://archive.org/details/bk1030/page/n7/mode/1up

realpatidar.com

વિશેષ અહેવાલ

બીલીમોરા સમાજ હવે ૧૦૦ ટકા સનાતની બની

બીલીમોરામાં ૧૪૦ સતપંથીઓની 'ઘર વાપસી'એ વિક્રમ સર્જયો

સતપંથી વિચારધારાને વરેલા બીલીમોરા સમાજના ૧૪૦ સભ્યો એકી સાથે સ્વેચ્છાએ કેન્દ્રીય સમાજના તમામ ઠરાવોનું પાલન કરવાની ખાત્રી સાથે સનાતની વિચારધારામાં જોડાતાં દક્ષિણ ગુજરાતમાં સનાતની ચળવળને જબરી સફળતા હાંસલ થઈ છે અને બીલીમોરા સમાજ હવે સંપૂર્ણ સનાતની સમાજ જાહેર થઈ ગઈ છે.

૧૦ માર્ચ, ૨૦૧૯ના બીલીમોરા સમાજ ભવનના હોલમાં સમાજના પ્રમુખ શ્રી પ્રાણલાલભાઈ પોકાર અને સનાતન સમાજના પ્રમુખ શ્રી નરસિંહભાઈ સાંખલાના અધ્યક્ષસ્થાને મળેલ સમાજની જનરલ મિટિંગમાં આ અભૂતપૂર્વ અને ઐતિહાસિક કાર્યવાહી જ્ઞાતિજનોની વિશાળ હાજરીમાં સંપન્ન થઈ હતી.

શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજની સનાતની વિચારધારા અને સતત પ્રયાસોનું ભારતભરમાં સુંદર પરિણામ આવી રહ્યું છે ત્યારે બીલીમોરાના ભાઈઓએ સાગમટે કેન્દ્રીય સમાજની નીતિ અને ઠરાવોનું પાલન કરવાની ખાત્રી સાથે અરજી આપીને સમાજના વિકાસમાં સહભાગી થવા કટીબદ્ધતા દર્શાવી હતી.

આ ઐતિહાસિક ઘટનાને સમસ્ત બીલીમોરા સનાતન સમાજે પેંડા વહેંચીને વધાવી લીધી હતી અને આવનાર સભ્યોને સન્માનપૂર્વક આવકાર્યા હતા. ભૂતકાળમાં જેના કારણે બીલીમોરા સમાજમાં વિખવાદ થયા હતા એ સંપૂર્ણ બાબત શાંતિમય રીતે ઉકેલાઈ જતા હવે બીલીમોરા સમાજ સંપૂર્ણ સનાતની જાહેર થઈ હતી.

સમાજના અગ્રણીઓ સર્વ શ્રી શીવજીભાઈ સાંખલા, દેવચંદભાઈ પોકાર, તેજાભાઈ નાકરાણી, રવજીભાઈ પોકાર, બાબુભાઈ જાદવાણી, મગનભાઈ માકાણી, કમલેશભાઈ માકાણી વગેરેએ બીલીમોરાની આજની ઘટનાને ઐતિહાસિક ગણાવી બીલીમોરા સમાજ હવે બમણા જુસ્સાથી પ્રગતિના પંથે જશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

સમગ્ર સભાનું સંચાલન કરતાં મહામંત્રી શ્રી ભરતભાઈ જાદવાણીએ જણાવ્યું હતું કે, આજે સતપંથી વિચારધારાવાળા તમામ પરિવારોને બીલીમોરા સમાજમાં જે ભવ્ય રીતે આવકારવામાં આવ્યા છે એજ રીતે કચ્છના જે તે ગામોની રસીદો આવી ગયા પછી દક્ષિણ ગુજરાત ઝોન સમાજમાં પણ આવકારીશું.

બીલીમોરા સમાજના પ્રમુખ શ્રી પ્રાણલાલભાઈ પોકારે આ કાર્યમાં સહયોગ આપનાર સર્વેને બિરદાવી, સનાતની વિચારધારાને વેગ આપવા અને કેન્દ્રીય સમાજના હાથ મજબૂત કરવા જ્ઞાતિજનોને આહ્‌વાન કર્યું હતું.

સમાજના મહામંત્રી ભરતભાઈએ આભારવિધિ કરી હતી. અલ્પાહાર બાદ બધા છૂટા પડ્યા હતા.

બીલીમોરા સમાજના પ્રમુખ શ્રી પ્રાણલાલભાઈ પોકારનો આ 'ઘર વાપસી' કાર્યક્રમ બાબતે ટેલિફોનીક સંપર્ક સાધતાં તેમણે ઉત્સાહભેર જણાવેલ કે લાંબા સમયથી અમે પ્રયાસો કરી રહ્યા હતા અને આખરે બીલીમોરાના આંગણે સનાતની સૂર્યોદય થતાં સમગ્ર સમાજમાં ખુશીનો માહોલ છવાયો છે.

કેન્દ્રીય સમાજના આદેશ અને દક્ષિણ ગુજરાત ઝોન સમાજના માર્ગદર્શન હેઠળ બીલીમોરા સમાજે આ સમગ્ર કાર્યવાહી આટોપી હોવાનું જણાવતાં પ્રાણલાલભાઈએ બીલીમોરાની સફળતા માટે સતપંથમાંથી આવેલ ૧૪૦ સભ્યોના સહકારને પણ બિરદાવ્યો હતો.

realpatidar.com

https://archive.org/details/bk1030/page/n8/mode/1up

2019-04 -Bilimora and Tamil Nadu -Satpanthis leaving (1030)

realpatidar.com

બીલીમોરાના જે ૧૪૦ સભ્યો સતપંથી વિચારધારા છોડી સનાતની વિચારધારામાં સામેલ થયા છે તેઓ કચ્છમાં નાગવીરી, રસલીયા, કાદીયા અને દેવપર (યક્ષ) ગામના છે. આ ચાર પૈકી નાગવીરી અને કાદીયા ગામના સ્થાનિક સનાતની સમાજની એન.ઓ.સી. આવી ગયેલ છે જ્યારે રસલીયા અને દેવપર (યક્ષ) ગામની કારોબારી મિટિંગો જન્માષ્ટમી પર મળવાની હોઈ ત્યારે મળશે. પરંતુ આ બંને ગામના સ્થાનિક સનાતની સમાજના પ્રમુખ સાથે વાતચીત થઈ ગઈ હોવાનું પણ બીલીમોરા સમાજના પ્રમુખશ્રીએ જણાવ્યું હતું.

દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર ભારતમાં બીલીમોરા 'ઘર વાપસી' કાર્યક્રમના સાનુકૂળ પ્રતિભાવો પડ્યા છે. સતપંથી વિચારધારા છોડીને સનાતનમાં આવેલા બીલીમોરાના ૧૪૦ સભ્યોના મુખ્ય વડા એવા કચ્છમાં દેવપર (યક્ષ)ના શ્રી દેવજીભાઈ કાનજી લીંબાણીએ ટેલિફોનીક વાતચીત દરમ્યાન જણાવેલ કે ઘણા સમયથી આ માટે ચર્ચા-વિચારણા ચાલુ હતી. ખાસ તો યુવાનોની ઈચ્છા હતી કે હવે સમયને અનુરૂપ આપણે પણ મુખ્ય પ્રવાહ સાથે ભળી જવું જોઈએ. યુવાનોની આ પ્રકારની લાગણીને વડીલોનું સમર્થન મળતાં બીલીમોરામાં આ ૧૦૦ ટકા શક્ય બન્યું છે અને તે માટે બીલીમોરાના સ્થાનિક સનાતની અગ્રણીઓ અને દક્ષિણ ગુજરાત સમાજના વડીલોનો પણ અમે આભાર માનીએ તેટલો ઓછો છે.

બીલીમોરાની આ ઐતિહાસિક ઘટના બાદ દક્ષિણ ગુજરાતના નવસારી સહિતના શહેરોમાં પણ સફળતા મળવાની આશા બંધાઈ છે.

ગ્રેનાઈટ

- ટેલિફોન બ્લેક, સુબલેક ડાર્ક, નાગારમ્ બ્લેક, ડીસી બ્લેક, ગ્રીન, રામાવરમ્ ગ્રેનાઈટ
- સ્ટીલ ગ્રે, બ્લેક પર્લ, ગેલેક્ષી ગ્રેનાઈટ
- ટેન બ્રાઉન, કોફી બ્રાઉન, હની બ્રાઉન, ઓરેન્જ બ્રાઉન, સફારી બ્લુ, ટેન બ્લેક, વગેરે ગ્રેનાઈટ મેળવવા માટે સંપર્ક કરો.

KHAMMAM : સુરેશભાઈ ધોળુ : ૯૪૪૦૧ ૬૦૯૮૩
MARTUR : મનોહરભાઈ ધોળુ : ૯૮૭૯૫ ૭૭૬૬૫, ૭૯૯૦૧ ૪૪૨૩૯
KARIMNAGAR : હિતેશભાઈ નાકરાણી : ૯૪૪૧૦૬૪૨૫૧, ૭૯૮૯૧૧૩૭૦૮

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com